



ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સંહતિ", છઠ્ઠો માળ, એસ.આઈ.ઈ.સી.સી. કેમ્પસ, ખજોદ ચાર રસ્તા પાસે, અલથાણ રોડ, સરસાણા, સુરત - ૩૯૫ ૦૦૭

ફોન નં. ૨૨૮૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

Ref no. PN 2025-26/257

Dt. 20/12/2025

તંત્રીશ્રી, _____, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,

(સેક્રેટરી)

ચેમ્બર દ્વારા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ (AIFTP – વેસ્ટર્ન ઝોન)ના સહયોગથી રાષ્ટ્રીય સ્તરનો ટેક્સ કોન્કલેવ યોજાયો

સુરત: ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ (AIFTP – વેસ્ટર્ન ઝોન)ના સહયોગથી શનિવાર, તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરતમાં ઉષાકાંત કંચનલાલ મારફતિયા હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે એક દિવસીય ‘નેશનલ ટેક્સ કોન્કલેવ ૨૦૨૫’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના ટેક્સ કોન્કલેવમાં ટેક્સેશન ક્ષેત્રના કાયદાકીય મુદ્દાઓ, વ્યવહારુ પડકારો તથા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુરતના ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ શ્રી રાજર્ષિ દિવેદી (IRS) ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિવિશેષ તરીકે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સના રાષ્ટ્રીય પ્રમુખ એડવોકેટ સમીર જાની હાજર રહ્યા હતા. એડવોકેટ શ્રી સમીર જાનીએ ગુજરાતને પ્રોજેક્ટ કરવાની એસોસિએશનના સભ્યોને હાંકલ કરી હતી.

મુખ્ય અતિથિ, સુરતના ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, શ્રી રાજર્ષિ દ્વિવેદી (IRS)એ જણાવ્યું હતું કે, થર્ડ પાર્ટી એટલે એવો વ્યક્તિ કે જે સીધો સર્ચનો મુખ્ય ટાર્ગેટ ન હોય, પરંતુ કોઈ રીતે ઇન્કમ ટેક્સની સર્ચ પ્રક્રિયામાં આવરી લેવાઈ જાય. વાસ્તવમાં સર્ચ સમસ્યાની શરૂઆત અહીંથી થાય છે. જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ એક વ્યક્તિને ત્યાં સર્ચ કરે છે, ત્યારે તેમની સામે મળતા પુરાવાઓના આધારે તેમના પરિવારજનો પણ આપમેળે તપાસના દાયરામાં આવી જાય છે, કારણ કે નાણાંકીય લેવડદેવડ હોવાની સંભાવના હોય છે અને ત્યાંથી શંકા અથવા માન્યતા ઊભી થાય છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ વ્યક્તિ સાથે સીધો સંબંધ ન ધરાવતા અન્ય લોકોનું શું? તેમના બેંક એકાઉન્ટ્સ, કાગળ પર દર્શાવેલા બિઝનેસ એસોસિએટ્સ અથવા અન્ય ઓળખાણો પણ તપાસના દાયરામાં આવી શકે છે. ઘણી વખત આવી માહિતી મજબૂત પુરાવા પર આધારિત ન હોવા છતાં કાર્યવાહી શરૂ થાય છે અને એ જ કારણસર સર્ચ સંબંધિત જોગવાઈઓ કાયદામાં લાવવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્ચ દરમિયાન કોઈ પણ ઘર અથવા ઓફિસમાંથી વિવિધ પ્રકારના દસ્તાવેજો અથવા સામગ્રી મળી શકે છે, કારણ કે તે રહેણાંક સ્થળ હોય છે. ઉદાહરણ તરીકે, જો વ્યક્તિના ઘરે તેમના પુત્રનો કોઈ મિત્ર, વ્યવસાયિક ઓળખાણ કે વિદેશી મિત્ર સાથે સંબંધિત દસ્તાવેજ મળી આવે તો તેના આધારે પણ શંકા ઊભી થાય છે. આ રીતે, ઘણી વખત એવા વ્યક્તિઓ પણ તપાસના દાયરામાં આવી જાય છે, જેમનો મુખ્ય ટાર્ગેટ વ્યક્તિ સાથે સીધો અથવા સ્પષ્ટ સંબંધ ન હોય અને તેઓ અજાણતા જ આ કાર્યવાહીનો ભોગ બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્ય પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી અને એના માટે કાયદામાં સમયાંતરે સુધારા થયા છે. વર્ષોથી કાયદામાં થતા ફેરફારોનો હેતુ એ જ રહ્યો છે કે, તપાસ અને કરદાતાના હકો વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકાય.

શ્રી રાજર્ષિ દ્વિવેદી (IRS)એ વધુમાં કહ્યું હતું કે, ‘ડમી દસ્તાવેજો’ એક ગંભીર સમસ્યા બની ગઈ છે, જે ખાસ કરીને સેક્શન ૧૫૩(સી) અને સર્ચ એસેસમેન્ટ્સ સાથે જોડાયેલી છે. હકીકત અને રેકૉર્ડ પર ઉપલબ્ધ તથ્યો ઘણી વખત એકસરખા હોતા નથી. ઘણી વખત નિર્ણય રેકૉર્ડ પર ઉપલબ્ધ તથ્યોના આધારે લેવાય છે, પરંતુ હકીકત તો હકીકત જ રહે છે. તેથી, ટેક્સ પ્રેક્ટિશનર્સની ફરજ છે કે તેઓ હકીકતને અવગણે નહીં. આ જ જવાબદારી અધિકારીઓની પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સર્ચ કાર્યવાહી દરમિયાન મળેલા દસ્તાવેજોનું મૂલ્યાંકન કરતી વખતે હકીકત, પરિસ્થિતિ અને પુરાવાના સાચા સ્વરૂપને ધ્યાનમાં લેવું અત્યંત આવશ્યક છે.

ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ શ્રી તુષાર હેમાણી ‘થર્ડ પાર્ટી સર્ચ અને ઇન્કમ ટેક્સ કાર્યવાહી પર તેની અસર’ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ કે સંસ્થા પર કરવામાં આવેલી સર્ચ અથવા સર્વે દરમિયાન જો અન્ય કરદાતાને લગતા દસ્તાવેજો, ડિજિટલ ડેટા કે પુરાવા મળી આવે, તો તેના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ સંબંધિત થર્ડ પાર્ટી સામે કાર્યવાહી કરી શકે છે. જોકે, આવી કાર્યવાહી કાયદેસર રીતે માન્ય રહે તે માટે વિભાગે નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, સેક્શન ૧૪૮(૩) હેઠળ એસેસમેન્ટ ફરીથી ખોલતા પહેલાં કરદાતાને યોગ્ય કારણો અને આધારની જાણ કરવી ફરજિયાત છે, જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થાય.

પૂણેના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પરિક્ષિત ઔરંગાબાદકરે એઆઈ પાવર્ડ ફાયનાન્સ અને ટેક્ષેશનમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, AIના ઉપયોગથી ટેક્સ કમ્પ્લાયન્સ વધુ ઝડપી, ચોક્કસ અને પારદર્શક બન્યું છે. રિટર્ન ફાઈલિંગ, સ્ક્રુટિની એનાલિસિસ, ડેટા

વેરિફિકેશન, રિસ્ક અસેસમેન્ટ તથા ફોડ ડિટેક્શન જેવી પ્રક્રિયાઓ હવે એઆઈ દ્વારા સરળતાથી અને ઓછા સમય માં શક્ય બની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, AI Powered ટૂલ્સ દ્વારા મોટા પ્રમાણમાં ડેટાનું વિશ્લેષણ કરીને યોગ્ય ટેક્ષ પ્લાનિંગ માટે મહત્વપૂર્ણ સૂચનો મેળવી શકાય છે, જેના કારણે કરદાતાઓ તેમજ પ્રોફેશનલ્સ બંનેને ફાયદો થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભવિષ્યમાં ટેક્ષ પ્રોફેશનમાં ટકી રહેવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્ષ કન્સલ્ટન્ટ્સે ટેકનોલોજી અને એઆઈ સાથે અપડેટ રહેવું અત્યંત જરૂરી બનશે.

અમૃતસરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રીમતી આંચલ કપૂરે ઓનલાઇન જોડાઈને જીએસટી પ્લેબુક અંતર્ગત GSTR-9/9C ફાઇલિંગ અને ટ્રિબ્યુનલ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, GSTR-9 અને GSTR-9C રિટર્ન ફાઇલિંગ દરમિયાન ડેટા રિકન્સિલિએશન, ઇનપુટ ટેક્ષ ક્રેડિટ (ITC) મિસમેચ, ટર્નઓવર ડિફરન્સ તથા ઓડિટ ટ્રેઇલ જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે નાની ભૂલ પણ ભવિષ્યમાં નોટિસ અથવા વિવાદનું કારણ બની શકે છે. તેમણે કરદાતાઓ અને પ્રોફેશનલ્સને સલાહ આપી હતી કે, અપડેટેડ કાનૂની જ્ઞાન, સચોટ રેકૉર્ડ-કીપિંગ અને જીએસટી પ્લેબુક જેવી પ્રેક્ટિકલ માર્ગદર્શિકાનો ઉપયોગ કરીને કમ્પ્લાયન્સ વધુ મજબૂત બનાવી શકાય છે.

ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ આભારવિધી કરી હતી. ચેમ્બરના માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે AIFTP (વેસ્ટર્ન ઝોન)ના ચેરમેન એડવોકેટ સચિન ગાંધીએ કન્કલુડીંગ રિમાર્ક્સ આપ્યા હતા.

ચેમ્બરની ઇન્કમ ટેક્ષ કમિટીના ચેરમેન સીએ પ્રજેશ જગાશેઠે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે કો-ચેરમેન સીએ અક્ષય મોદીએ ટેકનીકલ સેશનનું સંચાલન કર્યું હતું. આ કોન્કલેવમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખો સીએ પી.એમ. શાહ અને શ્રી રમેશ વઘાસિયા તથા સુરત ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગર, મુંબઈ, વલસાડ, વાપી, નાસિક, માલેગાંવ, નાગપુર, પૂણે અને જૂનાગઢ વગેરે શહેરોના ટેક્ષ પ્રોફેશનલ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ તથા ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા.